



This e-book was digitized from an original copy by the West African Research Association for the African Language Materials Archive (ALMA) project. Original funding for this project was provided by [UNESCO](#) and the [Council of American Overseas Research Centers \(CAORC\)](#) in cooperation with the [West African Research Association](#) and [Columbia University](#).

Please see the following web sites for more information about the ALMA project, contributing authors, and more titles in the series.

- Digital Library for International Research catalog: <http://catalog.crl.edu/search~S16>
- African Language Materials Archive (ALMA): <http://www.dliir.org/e-books.html>
- African language materials including interviews in video and PDF versions, documentary video, translation work, and bibliographies can be viewed at <http://alma.matrix.msu.edu>.



ዓለም የግድግዳ ግጥም ለግዛታ ባለች

፡ ለ ልዩ ልዩ ስራ ለግዛታ ግጥም ለግዛታ

604 91 81 = 16 19 204

19 / 01 / 1918



La première guerre mondiale
de 1914-1918

0911 : תעניתו ביום שבתו : וכן לא יאמר : וכן לא יאמר :
 וכן לא יאמר : וכן לא יאמר : וכן לא יאמר :
 וכן לא יאמר : וכן לא יאמר : וכן לא יאמר :
 וכן לא יאמר : וכן לא יאמר : וכן לא יאמר :

ועוד : וכן לא יאמר : וכן לא יאמר :
 וכן לא יאמר : וכן לא יאמר : וכן לא יאמר :
 וכן לא יאמר : וכן לא יאמר : וכן לא יאמר :

ועוד : וכן לא יאמר : וכן לא יאמר :
 וכן לא יאמר : וכן לא יאמר : וכן לא יאמר :
 וכן לא יאמר : וכן לא יאמר : וכן לא יאמר :

ועוד : וכן לא יאמר : וכן לא יאמר :
 וכן לא יאמר : וכן לא יאמר : וכן לא יאמר :

ועוד : וכן לא יאמר : וכן לא יאמר :

ועוד : וכן לא יאמר : וכן לא יאמר :
 וכן לא יאמר : וכן לא יאמר : וכן לא יאמר :
 וכן לא יאמר : וכן לא יאמר : וכן לא יאמר :

ועוד : וכן לא יאמר : וכן לא יאמר :
 וכן לא יאמר : וכן לא יאמר : וכן לא יאמר :

אשר יאמר ביום שבתו ביום שבתו

ועוד : וכן לא יאמר : וכן לא יאמר :
 וכן לא יאמר : וכן לא יאמר : וכן לא יאמר :
 וכן לא יאמר : וכן לא יאמר : וכן לא יאמר :

ועוד : וכן לא יאמר : וכן לא יאמר :

ועוד : וכן לא יאמר : וכן לא יאמר :

ועוד : וכן לא יאמר : וכן לא יאמר :



Իմ քննարկը և իմ քննարկը և իմ քննարկը և իմ քննարկը
 և իմ քննարկը և իմ քննարկը և իմ քննարկը և իմ քննարկը
 և իմ քննարկը և իմ քննարկը և իմ քննարկը և իմ քննարկը

Իմ քննարկը և իմ քննարկը և իմ քննարկը և իմ քննարկը



Իմ քննարկը և իմ քննարկը և իմ քննարկը և իմ քննարկը
 և իմ քննարկը և իմ քննարկը և իմ քննարկը և իմ քննարկը
 և իմ քննարկը և իմ քննարկը և իմ քննարկը և իմ քննարկը
 և իմ քննարկը և իմ քննարկը և իմ քննարկը և իմ քննարկը

Իմ քննարկը և իմ քննարկը և իմ քննարկը և իմ քննարկը



Ինք ին Եւս իւ Այ Է - ԲԿԵԷ Իւ Զիւճու Է - Իւ օՂ Էրէր օճ Է
 ԻՅ ՕՂԳԷ Է ԱՅ ԻՅԱՌԲԱՌԲ ԻՈՒՄԻ ԱՅ ԻԲՆԳՉՅ ԸՅԻՄ Է - Իւ ԱԵԻՅՅ
 . Իւ օճ ԻԲՈԻՑ ԱՅ ԻՅԱՌԲԱՌԲ ԷՅՅ ԻՈՒՄԻԸ ԱՅ օճԷ - ԲՅԳԷ



. ԳՂԳԷ Է Է ԷԷԲԷ Իւ Զիւճու օճԷ - Իւ օճ ԵՈՒՃՕՅՅ օճ Է
 ԻԲՅՅ ԵՅ Իւ ԷՅ Է - Զու ԶՅՄԸՅ Իւ օճ ԻԲԱՃԱՄ ԻՅՈՒՄ ԱՅ օճԷ
 Է Է - Զու ԷՅԱԵ ԳՕԳԷ ԿՕԳԷ Իւ ԱԵԻՅՅ Ինք Իւ Այ Է - Իւ
 ԶՅՄ ԱՅ ԻԲՆ ԻՅ ԻՈՒՄԻԸ . Զու ԷՃԵՅՈՒ ԷԲԱՅՅ ԵԵԵԵՅ ԻՈՒՄԻԸ
 Է օճ օճԷ՛ւ ԶԲ ԱԲՈ ԷՄՈ

... 000001 ...
... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

... 000001 ...

1929: 23rd Nov

1929: 23rd Nov

... ..
... ..
... ..

... ..
... ..
... ..
... ..
... ..

... ..
... ..
... ..
... ..

... ..
... ..
... ..

... ..
... ..
... ..
... ..

1929: 23rd Nov
1929: 23rd Nov

... ..
... ..
... ..
... ..

... ..
... ..
... ..

1929: 23rd Nov

1929: 23rd Nov

1929: 23rd Nov

1929: 23rd Nov

ታላላቅ ስራዎች ላይ ለማስፈጸም የሚያስፈልጉትን ገንዘብ በግብርና ቢሮ ለማግኘት ለማድረግ ለሚያስፈልጉት ሰነድ ማቅረብ ይገባል።

የሚያስፈልጉትን ሰነድ ማቅረብ ለማድረግ ለሚያስፈልጉት ሰነድ ማቅረብ ይገባል። ለሚያስፈልጉት ሰነድ ማቅረብ ይገባል። ለሚያስፈልጉት ሰነድ ማቅረብ ይገባል።

የሚያስፈልጉትን ሰነድ ማቅረብ ለማድረግ ለሚያስፈልጉት ሰነድ ማቅረብ ይገባል። ለሚያስፈልጉት ሰነድ ማቅረብ ይገባል። ለሚያስፈልጉት ሰነድ ማቅረብ ይገባል።


የሚያስፈልጉትን ሰነድ ማቅረብ ለማድረግ ለሚያስፈልጉት ሰነድ ማቅረብ ይገባል። ለሚያስፈልጉት ሰነድ ማቅረብ ይገባል። ለሚያስፈልጉት ሰነድ ማቅረብ ይገባል።

የግብርና ቢሮ ለማስፈጸም የሚያስፈልጉትን ሰነድ ማቅረብ ይገባል።

የሚያስፈልጉትን ሰነድ ማቅረብ ለማድረግ ለሚያስፈልጉት ሰነድ ማቅረብ ይገባል። ለሚያስፈልጉት ሰነድ ማቅረብ ይገባል። ለሚያስፈልጉት ሰነድ ማቅረብ ይገባል።

የሚያስፈልጉትን ሰነድ ማቅረብ ለማድረግ ለሚያስፈልጉት ሰነድ ማቅረብ ይገባል። ለሚያስፈልጉት ሰነድ ማቅረብ ይገባል። ለሚያስፈልጉት ሰነድ ማቅረብ ይገባል።

የሚያስፈልጉትን ሰነድ ማቅረብ ለማድረግ ለሚያስፈልጉት ሰነድ ማቅረብ ይገባል። ለሚያስፈልጉት ሰነድ ማቅረብ ይገባል። ለሚያስፈልጉት ሰነድ ማቅረብ ይገባል።



1871 - 1872
 1871 - 1872
 1871 - 1872
 1871 - 1872

1871 - 1872
 1871 - 1872
 1871 - 1872



1871 - 1872
 1871 - 1872
 1871 - 1872
 1871 - 1872

1. $\frac{1}{2} \times \frac{1}{3} = \frac{1}{6}$
 2. $\frac{1}{4} \times \frac{1}{5} = \frac{1}{20}$
 3. $\frac{1}{6} \times \frac{1}{7} = \frac{1}{42}$
 4. $\frac{1}{8} \times \frac{1}{9} = \frac{1}{72}$
 5. $\frac{1}{10} \times \frac{1}{11} = \frac{1}{110}$
 6. $\frac{1}{12} \times \frac{1}{13} = \frac{1}{156}$
 7. $\frac{1}{14} \times \frac{1}{15} = \frac{1}{210}$
 8. $\frac{1}{16} \times \frac{1}{17} = \frac{1}{272}$
 9. $\frac{1}{18} \times \frac{1}{19} = \frac{1}{342}$
 10. $\frac{1}{20} \times \frac{1}{21} = \frac{1}{420}$


11. $\frac{1}{22} \times \frac{1}{23} = \frac{1}{506}$
 12. $\frac{1}{24} \times \frac{1}{25} = \frac{1}{600}$
 13. $\frac{1}{26} \times \frac{1}{27} = \frac{1}{702}$
 14. $\frac{1}{28} \times \frac{1}{29} = \frac{1}{812}$
 15. $\frac{1}{30} \times \frac{1}{31} = \frac{1}{930}$
 16. $\frac{1}{32} \times \frac{1}{33} = \frac{1}{1056}$
 17. $\frac{1}{34} \times \frac{1}{35} = \frac{1}{1190}$
 18. $\frac{1}{36} \times \frac{1}{37} = \frac{1}{1332}$
 19. $\frac{1}{38} \times \frac{1}{39} = \frac{1}{1482}$
 20. $\frac{1}{40} \times \frac{1}{41} = \frac{1}{1640}$

21. $\frac{1}{42} \times \frac{1}{43} = \frac{1}{1806}$


22. $\frac{1}{44} \times \frac{1}{45} = \frac{1}{1980}$
 23. $\frac{1}{46} \times \frac{1}{47} = \frac{1}{2162}$
 24. $\frac{1}{48} \times \frac{1}{49} = \frac{1}{2352}$
 25. $\frac{1}{50} \times \frac{1}{51} = \frac{1}{2550}$
 26. $\frac{1}{52} \times \frac{1}{53} = \frac{1}{2756}$
 27. $\frac{1}{54} \times \frac{1}{55} = \frac{1}{2970}$
 28. $\frac{1}{56} \times \frac{1}{57} = \frac{1}{3192}$
 29. $\frac{1}{58} \times \frac{1}{59} = \frac{1}{3422}$
 30. $\frac{1}{60} \times \frac{1}{61} = \frac{1}{3660}$

31. $\frac{1}{62} \times \frac{1}{63} = \frac{1}{3906}$
32. $\frac{1}{64} \times \frac{1}{65} = \frac{1}{4160}$
33. $\frac{1}{66} \times \frac{1}{67} = \frac{1}{4422}$
34. $\frac{1}{68} \times \frac{1}{69} = \frac{1}{4692}$
35. $\frac{1}{70} \times \frac{1}{71} = \frac{1}{4970}$


36. $\frac{1}{72} \times \frac{1}{73} = \frac{1}{5256}$
 37. $\frac{1}{74} \times \frac{1}{75} = \frac{1}{5550}$
 38. $\frac{1}{76} \times \frac{1}{77} = \frac{1}{5852}$
 39. $\frac{1}{78} \times \frac{1}{79} = \frac{1}{6162}$
 40. $\frac{1}{80} \times \frac{1}{81} = \frac{1}{6480}$
 41. $\frac{1}{82} \times \frac{1}{83} = \frac{1}{6806}$
 42. $\frac{1}{84} \times \frac{1}{85} = \frac{1}{7140}$
 43. $\frac{1}{86} \times \frac{1}{87} = \frac{1}{7482}$
 44. $\frac{1}{88} \times \frac{1}{89} = \frac{1}{7832}$
 45. $\frac{1}{90} \times \frac{1}{91} = \frac{1}{8190}$
 46. $\frac{1}{92} \times \frac{1}{93} = \frac{1}{8556}$
 47. $\frac{1}{94} \times \frac{1}{95} = \frac{1}{8930}$
 48. $\frac{1}{96} \times \frac{1}{97} = \frac{1}{9312}$
 49. $\frac{1}{98} \times \frac{1}{99} = \frac{1}{9702}$
 50. $\frac{1}{100} \times \frac{1}{101} = \frac{1}{10100}$




0691 1913 10 12 07 2200 09 00 2200 09 00
 0900 091000 19 10 09 00 1000 1000 12 10 10
 1000 10 09 10 1000 09 1000 1000 10 10 10



10 10 10 10 10 10 10 10 10 10 10 10 10 10 10 10
 10 10 10 10 10 10 10 10 10 10 10 10 10 10 10 10
 10 10 10 10 10 10 10 10 10 10 10 10 10 10 10 10
 10 10 10 10 10 10 10 10 10 10 10 10 10 10 10 10



1914 ዓ.ም. ስምንት ሰዓት ለጊዜው ለጊዜው ለጊዜው
 ለጊዜው ለጊዜው ለጊዜው ለጊዜው ለጊዜው ለጊዜው
 ለጊዜው ለጊዜው ለጊዜው ለጊዜው ለጊዜው ለጊዜው
 ለጊዜው ለጊዜው ለጊዜው ለጊዜው ለጊዜው ለጊዜው



1914 ዓ.ም. ስምንት ሰዓት ለጊዜው ለጊዜው ለጊዜው
 ለጊዜው ለጊዜው ለጊዜው ለጊዜው ለጊዜው ለጊዜው ለጊዜው
 ለጊዜው ለጊዜው ለጊዜው ለጊዜው ለጊዜው ለጊዜው ለጊዜው

تَصَدَّقَ بِهَا مِمَّا يَتَّقُونَ قَا طَمَعَهُ هِي : تَحْتَمَتِجَ لَهَا مَلَأَ تَا
 لَعْلَامَ لَنْ مَلِيَّطَلَقَ لَلَا مِ لَأ : دَ مَلَلًا طَهَهُ لَلَمَلَا قَه صَا
 - تَحَلَّى نَحِيْبَهُ دَا قَا طَمَعَهُ تَحْتَمَتِجَ مَلِيَّ قَا لَلِيَّجَا تَحَلَّى
 تَحْتَمَتِجَ لَهَا طَهَهُ لَعْلَامَ مَحْبُودَ فَعَدَ طَمَعَهُ هِي لَعْلَامَ تَا
 لَمَلَا : دَ قَه تَحْتَمَتِجَ لَعْلَامَ لَنْ مَلِيَّطَلَقَ صَا تَا صَمَلِيَّ تَح
 كَه- مَا - لَمَلَا لَمَلَا .

تَحَلَّى نَحِيْبَهُ طَمَعَهُ مَلَأَ هِي : لَلِيَّطَلَقَ قَا تَحْتَمَتِجَ لَنْ هِيْجَا
 وَا دَ صَا : دَ هِي تَحْتَمَتِجَ لَمَلَا لَنْ تَحَلَّى مَلَلَا لَعْلَامَ قَه صَا ()
 لَطَلَا هِي قَا مَلَا) : لَعْلَامَ لَنْ صَمَلَا تَحَلَّى قَه نَحِيْبَهُ تَا
 هِي : قَه تَا لَعْلَامَ لَنْ تَا صَمَلَا قَه لِي دَ قَه صَمَلَا مَحْبُودَ
 لَنْ هِي لَنْ هِي- هِي مَحْبُودَ مَلِيَّطَلَقَ لَمَلَا (مَلِيَّ قَه لَمَلَا)

- طَمَعَهُ لَطَلَا هِي نَحِيْبَهُ قَا طَبَّ تَا لَعْلَامَ لَنْ مَلِيَّطَلَقَ مَلَمَلَا
 صَا قَه : تَحَلَّى قَالَمَلَا : لَعْلَامَ لَنْ قَا تَحَلَّى طَبَّطَلَمَلَا لَمَلَا
 قَا تَحْتَمَتِجَ لَنْ تَا طَا لَمَلَا نَحِيْبَهُ لَعْلَامَ مَحْبُودَ لَمَلَا قَا
 تَحْتَمَتِجَ لَنْ تَا قَه : لَعْلَامَ لَنْ تَا نَحِيْبَهُ تَحْتَمَتِجَ 000٢٢
 مَلَمَلَا - مَلَمَلَا : قَا لَمَلَا 0٥١ مَلَمَلَا لَمَلَا قَا .

لَعْلَامَ لَنْ قَا تَحْتَمَتِجَ لَمَلَا قَه طَهَهُ لَنْ تَا مَلِيَّطَلَقَ مَلَمَلَا لَمَلَا
 مَلَمَلَا نَحِيْبَهُ وَا لَمَلَا لَمَلَا مَلَمَلَا طَمَعَهُ لَطَلَا هِي : دَ قَه
 تَحْتَمَتِجَ لَنْ تَا لَمَلَا لَمَلَا لَعْلَامَ هِي تَا هِي مَلِيَّطَلَقَ

دَ لَمَلَا : لَعْلَامَ لَنْ مَلِيَّطَلَقَ لَمَلَا قَا مَلِيَّطَلَقَ قَه مَلَمَلَا صَا لَمَلَا
 لَطَلَا مَلَمَلَا (٢) لَمَلَا لَمَلَا مَلَمَلَا مَلَمَلَا قَا
 قَلَا : مَلِيَّطَلَقَ لَطَلَا نَحِيْبَهُ قَا لَمَلَا مَلَمَلَا نَحِيْبَهُ تَا
 مَلَمَلَا لَعْلَامَ لَمَلَا قَلَمَلَا قَلَمَلَا مَلَمَلَا : تَا لَعْلَامَ لَنْ قَا مَلَمَلَا
 لَمَلَمَلَا : دَا لَمَلَا مَلَمَلَا صَا .

قَلَا : مَلَمَلَا لَطَلَا لَمَلَمَلَا لَعْلَامَ لَنْ قَا : دَ نَحِيْبَهُ مَلَمَلَا
 لَعْلَامَ لَنْ قَا تَحْتَمَتِجَ مَحْبُودَ مَلَمَلَا : آ مَلَمَلَا صَا تَحْتَمَتِجَ مَلَمَلَا
 لَمَلَا قَا تَحْتَمَتِجَ هِي قَا مَلَمَلَا قَه لَمَلَا قَا
 دَ هِي : مَلَمَلَا لَمَلَا لَعْلَامَ لَنْ قَا تَحْتَمَتِجَ مَلَمَلَا مَلَمَلَا مَلَمَلَا
 مَلَمَلَا لَمَلَا قَه .

قَلَا : ٢١٩١ لَعْلَامَ لَنْ تَحَلَّى مَلَا لَمَلَا لَمَلَمَلَا صَا تَحْتَمَتِجَ
 مَلَمَلَا صَا مَلَا : قَلَا : طَبَّطَلَمَلَا (مَلَمَلَا) لَمَلَا قَا لَمَلَا مَلَمَلَا
 صَا مَلَمَلَا مَلَمَلَا صَا .

- ٢١٩١ لَعْلَامَ تَحْتَمَتِجَ هِي قَه مَلَمَلَا قَه لَمَلَا مَلَمَلَا صَا لَمَلَا
 هِي طَمَعَهُ هِي : لَمَلَا لَمَلَا لَمَلَا لَمَلَا لَمَلَا هِي لَمَلَا هِي
 طَبَّطَلَمَلَا لَمَلَا كَمَلَا هِي : تَحَلَّى لَمَلَا تَا لَمَلَا لَمَلَا لَمَلَا مَلَمَلَا
 لَمَلَمَلَا قَه هِي قَه (مَلَمَلَا مَلَمَلَا) .

لَمَلَا هِي صَا لَمَلَا هِي تَا لَمَلَا لَعْلَامَ لَنْ قَا تَحْتَمَتِجَ طَبَّ لَنْ
 لَمَلَمَلَا قَا مَلَا قَه مَلَمَلَا لَمَلَا قَه مَلَا كَه لَمَلَا هِي قَه قَه
 لَعْلَامَ لَنْ قَا مَلَا مَلَمَلَا مَلَمَلَا

... 1919 ...
... 1919 ...

1919 of 1919

... 1919 ...
... 1919 ...

... 1919 ...
... 1919 ...

1919 of 1919

... 1919 ...
... 1919 ...

... 1919 ...
... 1919 ...

... 1919 ...
... 1919 ...

1919 of 1919

... 1919 ...
... 1919 ...

... 1919 ...
... 1919 ...

ආර්ථික විද්‍යා විද්‍යාලය

කළු පත්‍රයේ දක්වා ඇති ප්‍රධාන ප්‍රශ්නවලට පිළිතුරු සපයා දීමට සිසුන් සූදානම් විය යුතුය. ප්‍රශ්න සහ පිළිතුරු පහත පරිදි වේ:

1. ප්‍රධාන ප්‍රශ්න: (a) ප්‍රධාන ප්‍රශ්න (b) ප්‍රධාන ප්‍රශ්න

2. පිළිතුරු: (a) පිළිතුරු (b) පිළිතුරු

ආර්ථික විද්‍යා විද්‍යාලය

ප්‍රධාන ප්‍රශ්න සහ පිළිතුරු පහත පරිදි වේ:

1. ප්‍රධාන ප්‍රශ්න: (a) ප්‍රධාන ප්‍රශ්න (b) ප්‍රධාන ප්‍රශ්න

2. පිළිතුරු: (a) පිළිතුරු (b) පිළිතුරු

ආර්ථික විද්‍යා විද්‍යාලය

ආර්ථික විද්‍යා විද්‍යාලය

විෂයය	අංකය	විෂයය	විෂයය
ආර්ථික විද්‍යා	1001	ආර්ථික විද්‍යා	1001
ආර්ථික විද්‍යා	1001	ආර්ථික විද්‍යා	1001
ආර්ථික විද්‍යා	1001	ආර්ථික විද්‍යා	1001
ආර්ථික විද්‍යා	1001	ආර්ථික විද්‍යා	1001
ආර්ථික විද්‍යා	1001	ආර්ථික විද්‍යා	1001

ආර්ථික විද්‍යා විද්‍යාලයේ ප්‍රධාන ප්‍රශ්න සහ පිළිතුරු පහත පරිදි වේ:

1. ප්‍රධාන ප්‍රශ්න: (a) ප්‍රධාන ප්‍රශ්න (b) ප්‍රධාන ප්‍රශ්න

2. පිළිතුරු: (a) පිළිතුරු (b) පිළිතුරු

... 00000000 ...

...

... ..

...

... ..

... ..

...

... ..

...

... ..

...

... ..

... ..

... ..

... ..

... ..

... ..

...

...

...

... ..

... ..

...

... ..

Auteur : _____

Mamoud Sangaré - Directeur de Publication du
Journal N'ko (Sindjiya) premier journal N'ko au Mali

Email : mamoube20012001@yahoo.fr

Tél. 604 91 81 - Bamako, Rép. du Mali